

ભાવનગર મહાનગરપાલિકા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા-૩૦/૧૨/૨૦૧૮ ના રોજ લેવાયેલ યુ.સી.એચ.સી તથા યુ.પી.એચ.સીના ગાયનેકોલોજીસ્ટ તથા તબીબી અધિકારી સંવર્ગની ભરતીની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી તા-૦૭/૦૨/૨૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરેલ હતી. આ સંવર્ગના પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ તથા ઓજસ વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ પ્રોવિઝનલ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી અને ત્યાર બાદ મૌખિક કસોટી માટે મહેકમ વિભાગ , મહાનગરપાલિકા, ભાવનગર ખાતે જાતે જ અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે. જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી આપોઆપ રદ થશે અને ત્યારપછી તે બાબતે કોઈ પણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની તમામે નોંધ લેવી.

જાહેરાત ક્રમાંક	સંવર્ગનું નામ	પ્રમાણપત્ર ચકાસણી તારીખ અને સમય	પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ મુજબ ઉમેદવારોનાં ક્રમાંક
BMC/201819/1	તબીબી અધિકારી	૨૭/૨/૨૦૧૯, સવારે ૯:૦૦ કલાકે	૧ થી ૩૭
BMC/201819/2	ગાયનેકોલોજીસ્ટ	૨૭/૨/૨૦૧૯, સવારે ૯:૦૦ કલાકે	૧ થી ૨

• ઉમેદવારે રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો (અસલ + સ્વપ્રમાણીત નકલ)

- ૧) ઉમેદવારની ઓનલાઇન અરજીની પ્રિન્ટ
- (૨) શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ (જાહેરાતમાં દર્શાવ્યા મુજબના)
- (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર /જન્મ તારીખ અંગેનું પ્રમાણપત્ર.
- (૪) કોમ્પ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્ર.
- (૫) જાતિ અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરેલ પ્રમાણપત્ર(લાગુ પડતુ હોય તો)
- (૬) સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જાહેરતામાં દર્શાવ્યા મુજબનું નોન- કિમીલેયર પ્રમાણપત્ર
- (૭) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં સિવિલ સર્જનનું નિયત પ્રમાણપત્ર.
- (૮) માજી સૈનિક કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં માજી સૈનિક હોવા અંગેના અધાર પુરાવા તથા ડીસ્યાર્જ બુક.

- (૯) વિધવા ઉમેદવારોના કિસ્સામાં વિધવા હોવા અંગેના પ્રમાણપત્રો તથા પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સંબંધિત મામલતદારશ્રીનું પ્રમાણપત્ર.
- (૧૦) આંતરરાષ્ટ્રીય/ રાષ્ટ્રીય/આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ/ શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલકુદ/રમતોના ખેલાડીઓના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબના નિયત નમુનાના જરૂરી પ્રમાણપત્ર.
- (૧૧) રાજ્યસરકાર/કેન્દ્રસરકાર/સ્થાનિક સત્તામંડળ/સરકારની માલીકીના બોર્ડ-નિગમ-કોર્પોરેશનની નોકરીમાં ચાલુ હોય તેવા ઉમેદવારના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારીનું "ના-વાધા પ્રમાણપત્ર"
- (૧૭) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ૦૨ ફોટા.

• અન્ય સુચના:-

- (૧) ઉમેદવારે જાતે જ સ્વખર્ચે આવવાનું રહેશે. પ્રમાણપત્ર ચકાસણી માટે તારીખ/સમય આપવામાં આવેલ છે, તે જ તારીખ/ સમયે ઉમેદવારે આવવાનું રહેશે.
- (૨) ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો ફરજિયાત પણે સાથે લાવવાના રહેશે, તથા દરેક પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરીને લાવવાની રહેશે.
- (૩) જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી આપોઆપ રદ થશે અને ત્યારપછી તે બાબતે કોઈ પણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની તમામે નોંધ લેવી.